

રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૧

-: અખબારી યાદી :-

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમિત અરોરાની ઉમદા નવી પહેલ : નિવૃત્તિના દિવસે જ અધિકારી/કર્મચારીઓને પી.એફ. સહિતના લાભો અપાયા

ગાર્ડન એન્ડ પાર્ક્સ શાખાના ડાઈરેક્ટરશ્રી ડો. કે.ડી.હાપલિયા સહિત છ કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા નિવૃત્તિ વિદાયમાન અપાયું: સાંજે ૬.૩૦ કલાકે યોજાયેલા કાર્યક્રમની બે કલાક પૂર્વે ૪.૦૦ વાગ્યે નિવૃત્ત સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા કરી દેવાયા

તા. ૦૧-૧૦-૨૦૨૧

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે અને તેનો અમલ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવતા અધિકારી/કર્મચારી સમૂહમાં આનંદની લાગણી પ્રસરી છે અને આ નવી ઉમદા પહેલ માટે કમિશનરશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ગઈકાલે પુરા થયેલા સપ્ટેમ્બર-૨૦૨૧નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ સદસ્યોમાં ગાર્ડન એન્ડ પાર્ક્સ શાખાના ડાઈરેક્ટરશ્રી ડો. કે.ડી.હાપલિયા, ટેક્સ બ્રાંચ(ઈસ્ટ ઝોન)નાં સિનિયર ક્લાર્ક શ્રી જીતેન્દ્રભાઈ કાંતિલાલ જોશી, આરોગ્ય શાખાના ડ્રાઈવર શ્રી જેરામભાઈ છગનભાઈ વીરસોડીયા, ગાર્ડન શાખાના સ્વીપર લેબર શ્રી મંજુલાબેન ખીમજીભાઈ મકવાણા, સ્પેશિયલ કન્ઝર્વેન્સીનાં લેબર શ્રી વિક્રલભાઈ ભીખુભાઈ ચૌહાણ અને સુરક્ષા વિભાગના વોચમેન શ્રી રાજુભાઈ ગોવિંદભાઈ રાહોડનો સમાવેશ થાય છે.

ગઈકાલે તા. ૩૦-૦૯-૨૦૨૧ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાના વરદ હસ્તે અધિકારી / કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ તેમણે નિવૃત્ત થયેલા સભ્યોને તંદુરસ્ત દીર્ઘાયુની શુભેચ્છા પણ પાઠવી હતી અને નિવૃત્તિ વિદાયમાન શુભેચ્છા પત્ર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે ૬.૩૦ કલાકે યોજાયેલા આ કાર્યક્રમની બે કલાક પૂર્વે ૪.૦૦ વાગ્યે નિવૃત્ત સ્ટાફના બેંક ખાતામાં પી.એફ. સહિતના નાણાં જમા કરી દેવાયા હતાં. ગ્રેયુઈટીની રકમ તા.૫-૯-૨૦૨૧ સુધીમાં જમા થઈ જશે અને પેન્શન સંબંધી પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવેલ છે.

આ અવસરે કમિશનરશ્રીએ તેમના વક્તવ્યમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં હાથપગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તેમના જીવનનાં અતિ મહત્વના વર્ષો મહાનગરપાલિકાને આપે છે. નિવૃત્ત થયેલ મનપાનાં સદસ્યોએ તેમની જિંદગીનો મહત્વનો જે સમય મનપા અને રાજકોટને આપ્યો છે તે બદલ તંત્ર તેમનો આભાર વ્યક્ત કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, નિવૃત્ત થતા અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા હક્ક રજા સહિતના લાભો મળી જાય એ સુનિશ્ચિત થાય એ પણ એટલું જ જરૂરી છે. મહાનગરપાલિકાએ હવેથી આ પ્રણાલી શરૂ કરી છે.

આ સમારોહમાં નાયબ કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર અને શ્રી ચેતન નંદાણી, ચીફ ઓડિટર શ્રી રીતેશભાઈ જે. શાહ, ચીફ એકાઉન્ટન્ટ શ્રી અમિત સવજીયાણી, ડીવાય.એસ.પી. શ્રી આર. બી. ઝાલા, સહાયક કમિશનર શ્રી સમીર ધડુક, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. મનિષ યુનારા, પી.એ. ટુ કમિશનર શ્રી એન. કે. રામાનુજ, પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, આસીસ્ટન્ટ મેનેજરો શ્રી મનિષ વોરા, શ્રી કાશ્મીરા વાઢેર, શ્રી વિપુલ ઘોણીયા, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા